



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૭/૦૫/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૫૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૮ કેસ કરી, ૪૨ વ્યક્તિઓને ઝડપી, ૪૪૮ લીટર દેશી દારૂ, ૨૦૯ બોટલ ઇંગ્લીશ દારૂ, ૩૪ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૧ કાર અને ૨ સ્કૂટર કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૭,૧૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૫૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૧ વ્યક્તિની અને પાસા હેઠળ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૮૫૩/૧૯

નિકોલ: હિતેષભાઈ બળવંતભાઈ ત્રીવેદી (રહે. શિવમ ફ્લેટ, ૮૦ ફુટ રોડ, રતનપાર્ક સોસાયટી વિભાગ-૨, નિકોલ રોડ) એ તા.૧૬/૫/૧૯ નારોજ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૪/૧૯ સાજના ૬/૪૫ વાગ્યાના સુમારે હિતેષભાઈના ભાઈ નિલેશભાઈ ત્રીવેદી નિકોલ પંચમ મોલ ખાતે આવેલ એસ.બી.આઇ એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે ત્રણ અજાણ્યા પુરૂષોએ નિલેશભાઈનું એ.ટી.એમ.લઈ યુક્તિ પ્રયુક્તિ કરી એ.ટી.એમ.મેળવી લઈ તા.૨૮/૪/૧૯ કલાક ૧૧/૫૨ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન નિલેશભાઈના ખાતામાંથી એ.ટી.એમ.દ્વારા કુલ રૂપિયા ૬૦,૦૦૦/- ઉપાડી લઈ છેતરપીંડી કરી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એચ.વી.છાસટીયા ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી ઝુટવી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૮૫૪/૧૯

એલીસબ્રીજ: જીનલકુમાર દિનેશભાઈ શાહ (ઉ.વ.૩૦) (રહે. નિત્યાનંદ ફ્લેટ સાધના સ્કૂલ સામે પ્રિતમનગર અખાડા પાલડી) તા.૧૫/૫/૧૯ રાતના ૯/૪૫ વાગ્યાના સુમારે પ્રિતમનગર અખાડા નીત્યાનંદ ફ્લેટના મેઈન ગેટ આગળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ જીનલકુમાર શાહના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/-ખેચી તોડી ઝુટવી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ જીનલબહેન શાહે એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.જી.ખાંભલા ચલાવે છે.

નરોડા: સંજયસિંહ સ/ઓ ઓમસિંહ સોલંકી (ઉ.વ.૩૦) (રહે.અંબિકાનગર તુલશીપાર્ક સામે જ્યોતિ હોટલ પાછળ નાના ચીલોડા) એ અગમ્ય કારણસર તા.૧૧/૫/૧૯ રાતના ૧૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં યાદર બાંધી ગળેફાસો ખાતા સારવાર માટે તેમને જી.સી.એસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૬/૫/૧૯ સાજના ૭/૧૦ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી અર્જુનસિંહ પ્રભાતસિંહ ચલાવે છે.

બાપુનગર: સવિતાબહેન વા/ઓ પ્રવિણભાઈ મકવાણા (ઉ.વ.૩૮) (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ બાપુનગર) એ બિમારીથી કંટાળી તા.૧૬/૫/૧૯ કલાક ૬/૩૦ થી ૭/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે રસોડામાં હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે બાપુનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એસ.દેસાઈ ચલાવે છે.

કાગડાપીઠ: રાહુલભાઈ ગોરધનભાઈ વાઘેલા (ઉ.વ.૧૮) (રહે. એકતાનગરની ચાલી મંજુરગામ) એ અગમ્ય કારણસર તા.૧૬/૫/૧૯ સવારના ૬/૨૦ વાગ્યા પહેલા પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી કે.જી.ચૌધરી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.